



Oshwal Online Jain Pathshala


Term 3 – Class 2

28 June 2021 – 8.00 – 9.15 pm

OAUK ઓનલાઇન જૈન પાઠશાળા

ટર્મ ૩- વર્ગ ૨

૨૮ જૂન ૨૦૨૧ – રાત્રે ૮.૦૦ – ૯.૧૫



ॐ

ॐ

નમસ્કાર (નવકાર) મંત્ર
Namaskar (Navkar) Mantra

નમો અરિહંતાણં
Namo Arihantanam

નમો સિદ્ધાણં
Namo Siddhanam

નમો આયરિયાણં
Namo Ayariyanam

નમો ઉવજ્ઞાયાણં
Namo Uvajjhayanam

નમો લોએ સવ્વ-સાહુણં
Namo Loe Savva Sahunam

એસો પંચ-નમુક્કારો
Eso Pancha Namukkaro

સવ્વ પાવ-પ્પણાસણો
Savva Pavappanasano

મંગલાણં ચ સવ્વેસિં
Mangalanam Cha Savvesim

પદમં હવઈ મંગલં
Padhamam Havai Mangalam



શ્રી સરસ્વતી દેવી સ્તુતિ	Shri Sarasvati Devi Stuti
શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી, હમકો વર દેના,	Shri Shrutdevi Sarasvati Bhaghvati, Hamko Var Dena,
જીવન કી બાંસુરી મેં દેવી, શ્રદ્ધા સ્વર ભર દેના,	Jivan Ki Bansuri Me Devi, Shraddha Svar Bhar Dena,
સમ્યગ જ્ઞાનકા દીપ જલાકર, મનકા તિમીર હટાના,	Samyag Gyan Ka Deep Jalaakar, Man Ka Timir Hataana,
ના ભૂલેના ભટકે માતા, ઐસી રાહ બતાના.	Na Bhulena Na Bhatke Mata, Aisi Raah Bataana.
શ્રી સરસ્વતી દેવી મંત્ર	Shri Sarasvati Devi Mantra
ૐ ઐમ્ નમઃ	Om Aiim Namah!




	સ્તુતિ		Stuti
૧	દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપ નાશનમ્, દર્શનં સ્વર્ગ સોપાનં, દર્શનં મોક્ષ સાધનમ્.	1	Darshanam Dev Devasya, Darshanam Paap Naashanam, Darshanam Svarg Sopaanam, Darshanam Moksha Saadhanam.
૨	દયાસિંધુ દયાસિંધુ, દયા કરજે દયા કરજે, મને આ જંજીરોમાંથી, હવે જલદી છૂટો કરજે. નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાળા, વરસાવી પ્રેમની ધારા, હૃદયની આગ બુઝવજે.	2	Daya Sindhu Daya Sindhu, Daya Karje Daya Karje, Mane Aa Zanziromaathi, Have Jaldi Chhuto Karje. Nathi Aa Taap Sahevaato, Bhabhuki Karmani Jvaala, Varsaavi Premni Dhaara, Hradhayani Aag Bujaavje.
૩	દાદા તારી મુખ મુદ્રાને, અમિય નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો. ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો.	3	Dada Taari Mukh Mudraane, Amiya Najare Nihaali Rahyo, Taara Nayanomaathi Zhartu, Divya Tej Hun Zhili Rahyo. Skshanbhar Aa Sansaar Ni Maaya, Taari Bhakti Ma Bhuli Gayo, Tuj Murtima Mast Banine, Aatmik Anand Maani Rahyo.

ચૈત્યવંદન વિધિ સૂત્રો			Chaityavandan Vidhi Sutra		
	સૂત્ર	રહસ્ય		Sutra	Significance
૧	શ્રી પંચાંગ પ્રણિપાત સૂત્ર	ઇચ્છામિ ખમાસમણો – ગુરુ ભગવંતોને થોભવંદન	1	Shri Panchaang Pranipaata Sutra	Ichchaami Khamasamano – Thobh Vandan to Guru Bhagwants
૨	શ્રી ઇરિયાવહિયં સૂત્ર	જીવવિરાધના જાણતા અજાણતા થઈ હોય તેની ક્ષમાપના	2	Shri Iriyavahiyam Sutra	Repentance/forgiveness for knowingly or unknowingly causing injury to living beings
૩	શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર	પાપોની વિશેષ આલોચના અને ક્ષમાપના - આત્માનું વિશેષ શોધન - આત્મશુદ્ધિ	3	Shri Tassa Uttari Sutra	Contemplation of and forgiveness for sins/wrong doings – purification /upliftment of the soul
૪	શ્રી અન્નત્થ સૂત્ર	કાઉસ્સગ્ગના સોળ આગારો (છૂટો) ની ગણના	4	Shri Annattha Sutra	Description of the sixteen exemptions (permissible movements) of Kaussagga
૫	શ્રી લોગસ્સ સૂત્ર	૨૪ તીર્થકરોનાં નામ અને મહિમા સાથે સ્તવના	5	Shri Logassa Sutra	Praising and appreciating the attributes of the 24 Tirthankaras with their names
૬	શ્રી જંકિંચિ સૂત્ર	ત્રણે લોકમાં રહેલાં નામરૂપ તીર્થો અને જિનપ્રતિમાઓને વંદન	6	Shri Jankinchi Sutra	Salutations to all named pilgrimage sites and Jina idols in the three worlds

૭	શ્રી નમુત્થુણં સૂત્ર	અરિહંત ભગવાનનાં જુદાં જુદાં પાંત્રીસ વિશેષણો દ્વારા સ્તુતિ	7	Shri Nanutthunam Sutra	Praising of the various thirty-five attributes of Arihantas
૮	શ્રી જાવંતિ ચેઈઆઈ સૂત્ર	ત્રણ લોકમાં બિરાજેલી જિન પ્રતિમાઓને/ચૈત્યોને વંદન	8	Shri Jaavanti Cheiaim Sutra	Obeisance to the images or idols of Jinas that exist in the three worlds
૯	શ્રી જાવંત કે વિ સાહુ સૂત્ર	ત્રણે લોકના સાધુ-સાધ્વીજીઓને વંદન	9	Shri Jaavant Kevi Saahu Sutra	Obeisance to all the Sadhus- Saadhvis of the three worlds
૧૦	શ્રી નમોર્હત સૂત્ર	પંચ પરમેષ્ઠિને નમસ્કાર. આ સૂત્ર ભાઈઓને બોલવાનો અધિકાર છે. બહેનોએ એક નવકાર મંત્ર બોલવો	10	Shri Namorhat Sutra	Respect to the five supreme beings. This Sutra is to be recited by men. Ladies to recite one Navkar Mantra.
૧૧	શ્રી ઉવસગ્ગહરં	શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તૂતિ - ઉપસર્ગો અને વિઘ્નો ટાળવાની માંગણી	11	Shri Uvassaggaharam Stotra	Stavana of Shri Parshvanath Prabhu – request to be free from sorrows and difficulties
૧૨	શ્રી જયવીયરાય સૂત્ર	પરમાત્માની સ્તવના સાથે તેર પ્રકારની પ્રાર્થના	12	Shri Jayviyaraay Sutra	Stavna of Parmatma with recitation of thirteen prayers
૧૩	શ્રી અરિહંત ચેઈયાણં સૂત્ર	અરિહંત ભગવાનને વંદનાદિ અર્થે કાઉસસગ્ગમાં રહેવું	13	Shri Arihant Cheiaim Sutra	Undertaking to remain in Kaussagga for the sake of obeisance, worship and reverence

ચૈત્યવંદન વિધિ	Chaityavandan Vidhi
ચૈત્યવંદનનો અર્થ - ચૈત્યવંદનમાં પ્રભુના ગુણોની વંદના કરવામાં આવે છે. ચૈત્યવંદન એ ભાવપૂજા છે અને આપણા શુભ ભાવોની વૃદ્ધિ થતાં પરમાત્મા સાથેનો સંબંધ જોડાય છે અને આપણી દરેક આધિવ્યાધિ ઉપાધિ દૂર થાય છે.	In Chaityavandan we praise the Parmatma. Chaityavandan is a Bhaav Puja and by attaching ourselves to Parmatma, we can achieve a higher sense of love and affection for Him, and all our worries and fears are alleviated.
ત્રીજી નિસીહિ	Third Nisihi
દેરાસરમાં ચૈત્યવંદનની શરૂઆત પહેલાં ત્રીજી નિસીહિ બોલવી.	Recite the third Nisihi prior to commencing the Chaityavandan in the Derasar.
ત્રીજો પ્રણામ	Third Pranam
સૌ પ્રથમ ત્રણ વાર જમીનને પૂંજી (પ્રમાર્જના ત્રિક) પ્રણામ ત્રિકનો છેલ્લો પંચાંગ પ્રણિપાત પ્રણામ કરવો (ખમાસમણ દેવું). ત્યાર બાદ ચૈત્યવંદન કરવું.	First, clean the ground thrice (Pramaarjna Trik), and perform Panchaang Pranipaata Pranam, the third pranam of the Pranam Trik (Khamasaman Sutra) and then commence the Chaityavandan.

	ખમાસમણ સૂત્ર - (પંચાંગ પ્રણિપાત)	૧ એક ખમાસમણ દેવું. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મત્થએણ વંદામિ	1 Offer one Khamasaman Ichchhami khama-samano! Vandium Javanijjae Nisihiae, Matthaen Vandaami
--	----------------------------------	--	--



<p>ચૈત્યવંદન પહેલાં ભાવશુદ્ધિ માટે લાગેલા દોષોને માફી આપવા ઇરિયાવહીની વિધિ કરવી. તે વિધિમાં ઇરિયાવહીયં સૂત્ર, તસ્સ ઉત્તરી સૂત્ર, અન્નત્થ તથા લોગાસ સૂત્ર અથવા ચાર નવકારનો કાર્યોત્સર્ગ ઊભા રહીને કરવાનો હોય છે.</p>	<p>Before Chaityavandan, to cleanse the mind and to ask for forgiveness for our sins, perform the Iriyavahiyam vidhi. In this vidhi, Irvahiyam Sutra, Tassa Uttari Sutra, Annatha Sutra are recited and then Kayotsarg of Logassa or four Navkar is performed in standing posture.</p>
---	--

યથાજાત મુદ્રા Yathajata Mudra



નીચેનો પાઠ કરવો

શ્રી ઇરિયાવહિયં સૂત્ર - શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર - શ્રી અન્નત્થ ઉસસિએણં સૂત્ર


Recite the following:

Iryavahiyam Sutra- Tassa Uttari Sutra – Annattha Usasienam Sutra

૨	શ્રી ઇરિયાવહિયં સૂત્ર	2	Shri Iriyavahiyam Sutra
	ઇચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિયં		Ichchhakaarena Sandisaha Bhagavan! Iriyaavahiyam
	પડિક્કમામિ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં (૧)		Padikkamaami? Ichchham, Ichchhaami Padikkamium
	ઇરિયાવહિયાએ વિરાહણાએ (૨)		Iriyavahiyaae, Viraahanaae (2)
	ગમણાગમણે (૩)		Gamanagamane
	પાણ-ક્કમણે, બીઅ-ક્કમણે, હરિય-ક્કમણે		Paana-kkamane, Biya-kkamane, Hariya-kkamane
	ઓસા-ઉત્તિંગ, પણગ-દગ-મટ્ટી-મક્કડા		Osa Utting, Panagadaga-matti-makkada
	સંતાણા સંકમણે (૪)		Santaana Sankamane
	જે મે જીવા વિરાહિયા (૫)		Je Me Jiva Viraahiya (5)
	એગિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા (૬)		Egindiya, Beindiya, Teindiya, Chaurindiya Panchindiya (6)
	અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈઆ, સંઘટ્ટિયા		Abhihaya, Vattiya, Lesiya, Sanghaaiya, Sanghaattiya
	પરિયાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાઓ ઠાણં સંકામિયા		Pariyaaviya, Kilaamiya, Uddaviya, Thaanao Thaanam, Sankaamiya
	જીવિયાઓ વવરોવિયા,		Jiviyao Vavaroviya
	તસ્સ મિચ્છામિ દુક્કડં (૭)		Tassa Michchhaami Dukkadam (7)
	ભાવાર્થ: આ સૂત્રમાં અત્યાર સુધી કરેલાં પાપો અને જિવ હિંસાની માફી માંગવામાં આવે છે.		Significance: Asking for forgiveness for causing injury to all living beings while moving around.
૩	શ્રી તસ્સ ઉત્તરી સૂત્ર	3	2. Shri Tassa Uttari Sutra
	તસ્સ ઉત્તરી કરણેણં		Tassa Uttarikaranenam
	પાયચ્છિત્તકરણેણં, વિસોહિકરણેણં		Paayachchhittakaranenam, Visohikaranenam
	વિસલ્લીકરણેણં		Visallikaranenam

	પાવાણં કમ્માણં, નિગ્ધાયણઠાએ		Paavanam Kammaanam, Niggdhaayanathaaye
	ઠામિ કાઉસસઝાં (૧)		Thaami Kaussaggam (1)
	ભાવાર્થ: શ્રી તસસ ઉત્તરી સૂત્ર બોલવાથી પાપોની વિષેશ શુદ્ધિ થાય છે.		Significance: Further sins are destroyed by reciting Shri Tassa Uttari Sutra.
૪	શ્રી અન્નત્થ ઊસસિએણં સૂત્ર	4	Shri Annattha Oosasionam Sutra
	અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં		Annattha Oosasionam, Niasasionam, Khaasionam,
	છીએણં, જંભાઈએણં, ઉદ્ડુએણં, વાય-નિસઝોણં		Chhienam, Jambhaaienam, Udduenam
	ભમલીએ, પિત્તમુચ્છાએ (૧)		Bhamalie, Pittamuchchhaae (1)
	સુહુમેહિં અંગસંચાલેહિં		Suhumehim Angasanchaalehim
	સુહુમેહિં ખેલસંચાલેહિં		Suhumehim Khelsanchaalehim
	સુહુમેહિં દિઢ્ઢિસંચાલેહિં, (૨)		Suhumehim Ditthisanchaalehim (2)
	એવમાઈએહિં આગારેહિં, અભઝો અવિરાહિઓ		Ēvamaaiehim Aagaarehim, Abhaggo Aviraahio
	હુજ્જ મેં કાઉસસઝો (૩)		Hujja Me Kaussaggo (3)
	જાવ અરિહંતાણં ભગવંતાણં		Jav Arihantaanam Bhagvantaanam
	નમુક્કારેણં, ન પારેમિ (૪)		Namukkaarenam, Na Paaremi (4)
	તાવ કાયં, ઠાણેણં, મોણેણં		Taav Kaayam, Thaanenam, Monenam
	આણેણં, અખ્પાણં વોસિરામિ (૫)		Jhaanenam, Appaanam Vosiraami (5)
	ભાવાર્થ: આ સૂત્રમાં કાઉસસગના સોળ આગારોનું વર્ણન તથા કેમ ઊભા રહેવું તે બતાવેલ છે.		Significance: This Sutra describes the sixteen exceptions (Agars) of Kaussagga as well specifies the standing postures.
	પછી એક લોગસસ (ચંદેસુ નિમ્મલયરા સુધી) અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસસઝા કરવો.		Then perform Kaussagga by reciting Logassa (up to Chandesu Nimalaraya) or four Navkar Mantra.

જિન મુદ્રા - કાઉસગ્ગા મુદ્રા - Jin Mudra Kaussagga Mudra



ઊભા ઊભા ડાબા હાથમાં ચરવળો રાખી અથવા બેસીને (બતાવ્યા મુજબ ચરવળો રાખી), જમણા હાથમાં મુહપત્તિ રાખી નીચેનો પાઠ કરવો:
શ્રી લોગસસ સૂત્ર
 Standing with Charvalo in the left hand or sitting (with Charvalo as shown) and Muhappati in the right hand, recite the following:
Shri Logassa Sutra

૫	શ્રી લોગસસ સૂત્ર	5	Shri Logassa Sutra
	લોગસસ ઉજ્જોઅગરે		Logassa Ujjoagare,
	ધમ્મ તિત્થ ચરે જિણે		Dhamma-tittha-yare Jine,
	અરિહંતે કિત્તઈસ્સં		Arihante Kittaissam,
	ચઉવીસં પિ કેવલી (૧)		Chauvisampi Kevali (1)
	ઉસભ મજિઅં ચ વંદે		Usabha-Majjam Cha Vande,
	સંભવ મભિણંદણં ચ સુમઈં ચ		Sambhava Mabhinandanam Cha Sumaim Cha,
	પઉમપ્પહં સુપાસં		Paumappaham Supaasam,
	જિણં ચ ચંદ-પ્પહં વંદે (૨)		Jinam Cha Chanda-ppaham Vande (2)
	સુવિહિં ચ પુપ્ફદંતં		Suvihim Cha Puphadantam
	સિયલ સિજ્જંસ વાસુપુજ્જં ચ		Siala Sijjansa Vasupujjam Cha



વિમલ-મણંતં ચ જિણં		Vimala-manantam Cha Jinam,
ધમ્મં સંતિં ચ વંદામિ (૩)		Dhammam Santim Cha Vandaami (3)
કુંથું અરં ચ મલ્લિં		Kunthum Aram Cha Mallim
વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ		Vande Muni-suvvayam Nami-Jinam Cha
વંદામિ રિક્ક-નેમિં		Vandaami Ritthanemim
પાસં તહ વદ્ધમાણં ચ (૪)		Paasam Taha Vaddhamanam Cha (4)
એવંમ મએ અભિથુઆ,		Evam Mae Abhithua
વિહુયરયમલા		Vihuya-roya-mala
પહીણ-જર-મરણા		Pahina-jara-marana
ચઉ-વીસં પિ જિણ-વરા		Chau-visam Pi Jinavara
તિથયરા મે પસીયંતુ (૫)		Titthayara Me Pasiyanttu (5)
કિત્તિય વંદિય મહિયા		Kittiya Vandiya Mahiya
જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા		Je Ee Logassa Uttama Siddha
આરુગ્ગ બોહિલાભં		Aarugga Bohilabham
સમાહિ વરમુત્તમં દિંતુ (૬)		Samaahi Varamuttamam Dintu (6)
ચંદેસુ નિમ્મલયરા		Chandesu Nimmalayara
આઈચ્ચેસુ અહિયં પયાસયરા		Aichchesu Ahiyam Payaasayara
સાગરવર ગંભીરા		Saagarvar Gambhira
સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ (૭)		Siddha Siddhim Mam Disantu (7)
ભાવાર્થ: આ સૂત્રમાં ચોવીસ તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવે છે.		Significance: This Sutra is meant to offer obeisance to all the 24 Tirthankaras and adore their attributes.
કાઉસ્સગ્ગ પારીને 'નમો અરિહંતાણં' કહીને પ્રગટ લોગસ્સ બોલવો.		Then recite 'Namo Arihantanam' and recite Pragat Logassa (complete Logassa).



5	ત્રણ ખમાસમણ દેવાં.	6	Offer three Khamasaman
<p>ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મત્થએણ વંદામિ</p>	<p>Ichchhami khama-samano! Vandium Javanijjae Nisihae Matthaen Vandaami</p>		
<p>ખમાસમણ આપ્યા બાદ વીરાસને એટલે જમણો ઢીંચણ નીચે રાખી, ડાબો ઢીંચણ ઊંભો રાખી બેસવું. હાથની મુદ્રા યોગમુદ્રા રાખવી અને આદેશ માંગવો.</p>	<p>After offering three Khamasamanas, sit in Viraasan – the left knee up and the right knee down. Both hands folded in Yogmudra, seek permission to perform Chaityavandan.</p>		
 <p>અપવાદિક મુદ્રા.</p>	 <p>દેવવંદન, ચૈત્યવંદન તથા રાઈઅ પ્રતિક્રમણ વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વખતે ની મુદ્રા.</p>		
<p>ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? 'ઇચ્છં'</p>	<p>'Ichchhakarana Sandisaha Bhagwan! Chaityavandan Karun?'</p>		

	ચૈત્યવંદન કરવાની આજ્ઞા માંગી, આદ્યસ્તુતિ-સકલ કુશલવલ્લી બોલી ચૈત્યવંદન શરૂ કરવું.		After seeking permission to perform Chaityavandan, recite the Adhyastuti - Sakal Kushalavalli and commence the Chaityavandan.
૭	આદ્યસ્તુતિ - સકલ કુશલવલ્લી	7	Aadhyastuti - Sakal Kushalavalli
	સકલ કુશલવલ્લી, પુષ્કરાવર્તમેઘો,		Sakal Kushalavalli, Pushkaraavartamegho,
	દુરિતતિમિરભાનુ, કલ્પવૃક્ષોપમાન:		Durittimirbhaanu, Kalpavrukshopamaanah,
	ભવજલનિધિ પોત: સર્વ સંપતિ હેતુ:		Bhavajalanidhi Potah, Sarva Sampattihetuhu,
	સ ભવતુ સતતં વ: શ્રેયસે શાંતિનાથ:		Sa Bhavatu Satatam Vah, Shreyase Shantinathaha,
	શ્રેયસે પાર્શ્વનાથ:		Shreyase Parshvsnathaha.
	ભાવાર્થ: આ સૂત્ર દ્વારા શ્રી શાંતિનાથ ભગવાનને તથા પાર્શ્વનાથ ભગવાનને સુખ પ્રાપ્તિ માટે, મનની અજ્ઞાનતા દૂર કરવા અને મનોકામના પૂરી કરવા અને સંસારરૂપી સમુદ્રમાંથી બહાર લાવીને આત્માને પરમપદની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.		Significance: We pray to Parmatma Shri Shantinath Bhagwan and Shri Parshwanath Bhagwan to bestow upon happiness, remove darkness of the mind and fulfil all our wishes and take us out of this worldly ocean and lift towards the salvation of our soul.
	ત્યારબાદ નીચેનું ચૈત્યવંદન કહેવું. અથવા બીજા કોઈ પણ ભગવાનનું ચૈત્યવંદન કહી શકાય.		Then recite the following Chaityavandan, or any Chaityavandan of any other Bhagwan can be recited.
૮	શ્રી મહાવીર સ્વામીનું ચૈત્યવંદન	8	Shri Mahavir Swami Chaityavandan
	સિદ્ધારથ સુત વંદીએ, ત્રીશલાનો જાયો,		Siddharath Sut Vandiyee, Trishla no Jaayo,
	ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયો.		Kshatriyakund Maa Avtariyo, Sur Narpati Gaayo.
	મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય,		Mrugapati Lanchan Paau Le, Saat Haath Ni Kaay,
	બહોંતેર વરસનું આયખું, વીર જિનેશ્વર રાય.		Bahonter Varsh Nu Aaykhu, Vir Jineshwar Raai.
	ખિમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત,		Khimaavijay Jinraayna Ae, Uttam Gun Avadaat,
	સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત.		Saat Bol Thi Varanviya, Padmavijay Vikhyaat.


	ત્યાર પછી યોગ મુદ્રામાં 'શ્રી જંકિંચિ', 'શ્રી નમત્થુણં', 'શ્રી જાવંતિ ચેઈઆઈ' સૂત્રો કહી અને એક ખમાસમણ દેવું.		Then in Yogmudra, recite Shri Jankinchi, Shri Namutthunam, shri Javanti Cheiaim Sutras and then offer one Khamasana.
૯	શ્રી જંકિંચિ સૂત્ર	9	Shri Jankinchi Sutra
	જં કિંચિ નામ તિત્થં, સગ્ગે પાયાલિ માણુસે લોએ,		Jan Kinchi Naam Tittham, Sagge Payaali Manuse Loe,
	જાઈં જિણ બિમ્બાઈં, તાઈં સવ્વાઈં વંદામિ		Jaaim Jin Bimbaim, Taiim Savvaim Vandaami
	ભાવાર્થ: ત્રણ લોક (સ્વર્ગમાં, નરકમાં, મનુષ્યલોક)ના તીર્થો તેમજ પ્રભુ પ્રતિમાઓને વંદન કરવાનું આ સૂત્ર છે.		Significance: To pay respect to all the places of pilgrimage and the idols of Jinas in the three Worlds (heavenly world, lower world and world of human habitation).
જંકિંચિ સૂત્ર (અર્થ સહિત)		Shri Jankinchi Sutra (with meaning)	
૧જં કિંચિ ૨નામ તિત્થં,	૧જે કોઈ ૨નામરૂપ તીર્થો છે	1Jan Kinchi 2Naam Tittham,	1whichever 2places of pilgrimage present by name
૩સગ્ગે ૪પાયાલિ ૫માણુસે લોએ,	૩સ્વર્ગલોકમાં ૪પાતાળલોકમાં ૫મનુષ્યલોકમાં	3Sagge 4Payaali 5Manuse Loe,	3in heavenly world 4in the lower world 5in the human world
૬જાઈં ૭જિણ બિમ્બાઈં	૬જેટલાં ૭જિનબિંબો	6Jaaim 7Jin Bimbaim	6as many 7idols of Jina be present
૮તાઈં ૯સવ્વાઈં ૧૦વંદામિ.	૮તે ૯સર્વને ૧૦ હું વંદું છું	8Taiim 9Savvaim 10Vandaami.	8to 9all of them 10I bow
અર્થ: સ્વર્ગ, પાતાળ અને મનુષ્ય લોકમાં જે કોઈ નામ માત્રથી પણ તીર્થો હોય અને ત્યાં જેટલી જિનેશ્વર ભગવંતોની પ્રતિમાઓ હોય તે સર્વને હું વંદન કરું છું.		Meaning: I bow down to all the places of pilgrimage and to the idols of the Omniscient in the heavenly world, lower world and the world of human habitation.	

૧૪ રાજલોક - 14 Rajlok






શ્રી અષ્ટાપદ તીર્થ



Shri Ashtapad Tirth



શ્રી અષ્ટાપદ તીર્થ

જૈન ધર્મનાં અનુયાયી માટે 'અષ્ટાપદ' સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. આ અષ્ટાપદ તીર્થ હિમાલયથી ઉત્તર દિશા તરફ જતાં આવે છે.

'અષ્ટપદ' એટલે આઠ પગથિયાં - પર્વત કે જિનાલય ચઢવા માટેના આઠ જબરદસ્ત પગથિયાં.

આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા.

આદિનાથ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ તેમના પિતાની સ્મૃતિમાં, અષ્ટાપદ પર્વત પર 'સિંહનિષઘા' નામનું રત્નજડિત જિનાલય બંધાવ્યું. ભરત ચક્રવર્તીએ 24 ભગવાનની, યક્ષ - યક્ષિણી યુક્ત 4 દિશામાં રત્નની મણિમય પ્રતિમા ભરાવી હતી. સાથે મરુદેવી માતા, 99 સંયમી ભાઈઓ, બ્રાહ્મી અને સુંદરીની પ્રતિમા ભરાવી હતી.

મહાવીર સ્વામી ભગવાને તેમના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે જે મનુષ્ય સ્વલબ્ધીથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને ત્યાં રાત રહીને ભગવાનની ભક્તિ કરે, મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જાય છે.

શ્રી મહાવીરસ્વામીના કાળમાં ગૌતમસ્વામીજી સૂર્યના કિરણો પકડી ઉપર યાત્રા કરી હતી અને જગચિંતામણી સૂત્રની કરવામાં આવી હતી. અષ્ટાપદની યાત્રા અનંત જન્મોના પાપકર્મોનો ક્ષય કરે છે.

Shri Ashtapad Tirth

Ashtapad is considered to be the holiest place for the followers of Jainism.

Ashtpad means eight steps – which could be eight giant steps to ascend the mountain or the temple

On the day of Mahavad 13, Adinath Bhagwan with 10000 sadhus attained Moksha from Ashtapada Mountain.

Bharat Chakraborty, son of Adinath Bhagwan, built a jinalay named 'Sinh-Nishadha' on Ashtapada Mountain as a memorial in commemoration of his father's Nirvana. The temple was made with crystal and gemstones. Bharat Chakraborty had arranged for jewelled statues to be placed in the 4 directions of the temple - of the 24 Tirthankaras with their Yaksh-Yakshanis (protectors), along with statues of Marudevi Mata, 99 brothers, Braahmi and Sundari.

Bhagwan Mahavir once said during his sermon that any human being, who can scale the mountain, stay overnight and worship the Bhagwan there will attain liberation in his life-time.

Shri Gautam Swami was able to complete his pilgrimage by special powers he possessed using the sun's rays. Gautam Swami wrote the first two verses of Jag Chintamani Sutra there.

સવાલોના જવાબ

ANSWERS TO QUESTIONS

ANSWERS TO QUESTIONS

Please email your Questions to:

jainism@oshwal.org

OR

Send a whats App message to


Shobha Harish Shah

ON

+44(07)958447298




JIN DARSHAN BOOK



A bilingual guide to performing Darshan Puja at a Jain Derasar

Sponsored and distributed by Sigma Pharmaceuticals Plc (UK) in collaboration with the Oshwal Association of the U.K.



If you have not already received a copy and would like to request your complimentary copy, please email:

jindarshan@sigmaplc.com

with your name and address

Watch live on Oshwal YouTube Channel <https://www.youtube.com/c/oshwaluk>
Oshwal Association of the UK Charity Reg. No. 267037. T&C apply, see website for details